

## अंबालामंडन श्री सुपार्श्वनाथ जिन स्तवन

क्युं न हो सुनाई साई, ऐसा गुन्हा क्या किया ?  
औरोकी सुनाई जावे, मेरी बारी नहीं आवे;  
तुम बिन कौन मेरा, मुजे क्युं भूला दिया;  
क्युं न हो सुनाई साई, ऐसा गुन्हा क्या किया ? १

भक्त जनों तार दीया, तारनेका काम किया;  
बिन भक्तिवाला मों पे, पक्षपात क्युं कीया.  
क्युं न हो सुनाई साई, ऐसा गुन्हा क्या किया ? २

राय रंक एक जानो, मेरा तेरा नहीं मानो;  
तरन तारन ऐसा, बिरुद धार क्युं लिया.  
क्युं न हो सुनाई साई, ऐसा गुन्हा क्या किया ? ३

गुन्हा मेरा बक्ष दीजे, मों पे अति रहेम कीजे;  
पक्का ही भरोसा तेरा, दिलोमें जमा लिया.  
क्युं न हो सुनाई साई, ऐसा गुन्हा क्या किया ? ४

तुंही एक अंतरजामी, सुनो श्री सुपास स्वामी;  
अब तो आशा पूरो मेरी, कहेना सो तो कह दिया.  
क्युं न हो सुनाई साई, ऐसा गुन्हा क्या किया ? ५

शहेर अंबाले भेटी, प्रभुजीका मुख देखी;  
मनुष्यजनमका ल्हावा, लेना सो तो ले लीया.  
क्युं न हो सुनाई साई, ऐसा गुन्हा क्या किया ? ६

उन्निसो छासठ छबीला, दीपमाला दिन रंगीला;  
कहे वीरविजय प्रभु, भक्ति में जमा लीया.  
क्युं न हो सुनाई साई, ऐसा गुन्हा क्या किया ? ७

- मुनिश्री वीरविजय (श्री आत्म-कमल-वीर-दान-प्रेमसूरि)

## (૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન

(સહજ સલુણા હો સાધુજી - એ દેશી)

પદ્મપ્રભ જિન જઈ અલગા રહ્યા, જિહાંથી નાવે લેખોજી;  
કાગળ ને મસી જિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેષોજી.  
સુગુણ સનેહા રે કદિય ન વિસરે. ૧

ઈહાંથી તિહાં જઈ કોઈ આવે નહિ, જેહ કહે સંદેશોજી;  
જેહનું મિલવું રે દોહિલું તેહશું, નેહ તે આપ કિલેશોજી.  
સુગુણ સનેહા રે કદિય ન વિસરે. ૨

વીતરાગશું રે રાગ તે એકપખો, કીજે કવણ પ્રકારોજી;  
ઘોડો દોડે રે સાહિબ વાજમાં, મન નાણે અસવારોજી.  
સુગુણ સનેહા રે કદિય ન વિસરે. ૩

સાચી ભક્તિ રે ભાવનરસ કહ્યો, રસ હોયેં તિહાં દોય રીઝેજી;  
હોડાહોડે રે બિહું રસરીઝથી, મનના મનોરથ સીઝેજી.  
સુગુણ સનેહા રે કદિય ન વિસરે. ૪

પણ ગુણવંતા રે ગોઠે ગાજીએ, મોટા તે વિશ્રામજી;  
વાયક જશ કહે એક જ આસરે, સુખ લહું ઠામોઠામજી.  
સુગુણ સનેહા રે કદિય ન વિસરે. ૫

## (૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવનનો અર્થ

શ્રી પદ્મપ્રભ જિનેશ્વરદેવ અહીંથી દૂર જઈને વસ્યા છે. ત્યાંથી પત્ર આવતો નથી, કાગળ અને શાહી ત્યાં મળતા નથી. સીધા ત્યાં જવા માટે અહીં વર્તમાનકાળે કોઈ વિશિષ્ટ માર્ગ પણ નથી. આ રીતે સ્નેહીજનો દૂર રહ્યા હોય તો પણ સુંદર ગુણોવાળા એ સ્નેહીજનો ક્યારેય પણ વિસરાતા નથી. મનથી ભૂલાતા નથી. ૧

અહીંથી ત્યાં જઈને કોઈ પાછું આવતું નથી, કે જે ત્યાંના સમાચાર આપી શકે. જેમનો મેળાપ થવો દુર્લભ છે, તેમની સાથે સ્નેહ રાખવો તે પોતાને દુઃખરૂપ છે. ૨

શ્રી વીતરાગ પરમાત્મા સાથે એકપક્ષીય રાગ કેવી રીતે કરવો? માલિકની લગામ અનુસાર ઘોડો વેગમાં દોડ્યા કરે, પણ તેના ઉપર સવારી કરનાર તે વાત મનમાંયે ન લાવે. (એ કેવું?) ૩

પ્રભુના સ્વરૂપની વિચારણારૂપ ભાવના રસને જ સાચી ભક્તિ કહી છે. જ્યાં રસ હોય ત્યાં બંને રીઝે છે. (એટલે હું રીઝું અને પ્રભુ ન રીઝે એમ ન થવું જોઈએ) એવી સ્પર્ધાથી જ, એકબીજાના રસની રીઝથી જ મનના મનોરથો સિદ્ધ થાય છે. ૪

પણ ગુણવાનની સોબતથી હું ગાજું છું કારણ કે મહાપુરુષો વિશ્રાંતિના સ્થાનરૂપ હોય છે. પૂ. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે એ જ પ્રભુના આશ્રયથી હું ઠેર-ઠેર સુખ અનુભવું છું. ૫